

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રેમ્પટનમાં સ્થિત તમામ કલાકારોને તમારી કથા કહેવાનું કહેણ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (04 જૂન 2021) – સિટી ઓફ બ્રેમ્પટનની નવસર્જિત આર્ટ્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ડેવેલપમેન્ટ એજન્સી (ACCIDA) કલાકારોને પોતાની કથા કહેવા અને ડિજિટલ પોસ્ટકાર્ડ પર પોતાની કલા પ્રદર્શિત કરવા જણાવે છે જે શહેરને એક પ્રેમપત્ર સમાન હશે.

દ પોસ્ટ કાર્ડ પ્રોજેક્ટ - તમારી કલાની કથા શેર કરો હવે સ્વીકારી રહ્યા છે 20 નવી અને જૂની ડિજિટલ અને વિઝ્યુઅલ કલાકૃતિઓની રજૂઆતો બ્રેમ્પટનના કલાકારો, સર્જકો, અને સંગીતકારો અને પર્ફોર્મરો પાસેથી જેથી તેઓ પોતાની કલા ડિજિટલ પોસ્ટકાર્ડ પર પ્રદર્શિત કરી શકે. તેવા કલાકારો પર ધ્યાન આપવામાં આવશે જેઓ બ્રેમ્પટન બહારના હોય પરંતુ જેમનું કામ બ્રેમ્પટનથી પ્રભાવિત થયું હોય તેમજ બ્રેમ્પટન સાથે સંકળાયેલ હોય જ્યાં અગ્રિમતા અપાશે તે કલાકારોને જેઓ બ્રેમ્પટનમાં નિવાસ કરતા હોય. આ તક માટે પસંદ કરાયેલ કલાકારોને \$250ની ફી એક સાથે ચૂકવાશે.

પોસ્ટકાર્ડ પ્રોજેક્ટના ભાગરૂપે - તમારી આર્ટિસ્ટ સ્ટોરી, ACCIDA તમારી કલાના ક્રેડિટ સહ તમારું કામ ડિજિટલ પોસ્ટકાર્ડ પર ACCIDAના સોશયલ મિડિયાના પ્લેટફોર્મ પર શેર કરશે જે આગામી પ્રમોશનલ અને માર્કેટિંગ પહેલોનો ભાગ બનશે. કલાકારો બહુવિધ છબીઓ રજૂ કરી શકશે અને તે એક કરતા વધુ વખત પસંદ થઈ શકે છે પરંતુ આશય તે છે કે આ તક સંભવ હોય એટલા વધુ કલાકારો સાથે પસંદ કરેલી 20 કૃતિઓની સીમામાં શેર કરી શકાય.

કલાકારોને સિટી સાથેના પોતાના જોડાણોને વાચા આપવા આવકારવામાં આવે છે જેથી તેઓ દર્શાવી શકે કે કેવી રીતે પોતાની કલામાં બ્રેમ્પટનના હાઈ અને વાતોને સમાવી શકાય છે. કલાકૃતિ નવી અથવા જૂની મૂળ રચના હોઈ શકે છે અને તેમાં કોઈપણ માધ્યમમાં હોઈ શકે છે, જેમ કે: ફોટોગ્રાફી, લેખિત કાર્ય, પ્રદર્શનનું દસ્તાવેજીકરણ, ડિજિટલ કોલાજ અને નોન-ડિજિટલ કૃતિઓ, જેમાં હાથથી દોરેલા ચિત્રો અને પેઈન્ટિંગ્સનો સમાવેશ થાય છે જે સ્પષ્ટીકરણો અનુસાર ડિજિટાઈઝ કરી શકાય છે. અમૂર્ત અને બિન-પ્રતિનિધિત્વ કૃતિઓનું આવકારવામાં આવે છે અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અરજી આપવાની અંતિમ તારીખ 17 જૂન 2021 છે. રજૂ કરાયેલ કૃતિઓનું મૂલ્યાંકન ACCIDA દ્વારા કરાશે. વધારાની માહિતી અથવા પ્રશ્નો માટે કૃપા કરીને પ્રોજેક્ટની વિગતો [અહીં](mailto:accida@brampton.ca) જુઓ, રજૂઆતો નીચેની વિષય પંક્તિ લખીને આ ઈમેલ પર મોકલશો.

accida@brampton.ca: યોર આર્ટિસ્ટ સ્ટોરી.

સુવાક્યો

"દ પોસ્ટકાર્ડ પ્રોજેક્ટ: શેર યોર આર્ટિસ્ટ સ્ટોરી 2040 માં તમામ કલાકારો, સર્જકો, સંગીતકારો અને કલાકારોની તકો સાથેના સાંસ્કૃતિક વાતાવરણને સમૃદ્ધ કલાના ફલકમાં પરિવર્તિત કરવા માટે 2040માં બ્રેમ્પટન માટે શહેરના વિઝનને સમર્થન આપે છે. હું સિટી ઓફ બ્રેમ્પટનમાં સ્થિત તમામ કલાકારોને તમારી કથા કહેવા આહવાન કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“જ્યારે સ્થાનિક કલા અને સાંસ્કૃતિક સમુદાય સાથે સંબંધ બાંધવા શરૂ કરી રહ્યા છે ત્યારે આ સિટી ઓફ બ્રેમ્પટન માટે આ રોમાંચક સમય છે. સ્થાનિક કલાકારોને તેમની વાર્તાઓ શેર કરવાથી એજન્સીને આ મહત્વપૂર્ણ સંબંધો બનાવવામાં મદદ મળશે અને સાથે જ બ્રેમ્પટનની કલાકૃતિઓને પ્રોત્સાહિત કરી શકાશે.”

- રોવેના સાન્નોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન

“કલાકારો માટેનો કોલ નવ-સર્જિત આર્ટ્સ, સંસ્કૃતિ અને ક્રિએટિવ ઉદ્યોગ વિકાસ એજન્સી (Arts, Culture and Creative Industry Development Agency)ની સ્થાપના કરવામાં મદદ કરશે જે બ્રેમ્પટનમાં એક મજબૂત, સર્જનાત્મક અને ઉદ્યોગસાહસિક સમુદાયને સમર્થન આપે છે, જે મહામારી પછીની દુનિયામાં સ્થાનિક અર્થતંત્રને ફરીથી ઊભું કરવામાં મદદ કરશે.”

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ (Media and Community Engagement)

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સિટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca